

(A Prayer for those who wish to serve the Divine.)

... ..

We stand here before Thee that Thy will may be fulfilled in us,  
in every element, in every activity of our being, from our

... ..

Grant that everything in us may collaborate in Thy work  
and all be ready for Thy realisation.

... ..

... ..

તારી સમક્ષ અમે આવ્યાં છીએ એટલા માટે કે તારી ઇચ્છા  
અમારામાં સિદ્ધ થાય, અમારા એકેએક તત્ત્વમાં, અમારી એકેએક  
પ્રવૃત્તિમાં, અમારી ચેતનાનાં ઉચ્ચોચ શિખરોથી માંડી અમારા  
શરીરના નાનામાં નાના અણુ સુધી.

... ..

અમારામાંની પ્રત્યેક વસ્તુ તારા કાર્યમાં સહકાર આપો. તારા  
સાક્ષાત્કાર માટે સર્વ કંઈ તૈયાર થાઓ.

... ..

- The Mother - શ્રી માતાજી

From Prayers and Meditations - October 23, 1937  
પ્રાર્થનાઓ અને ધ્યાનમાંથી - ૨૩ ઓક્ટોબર ૧૯૩૭




From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. © 0413-2331470

સ્વાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨૦ ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • May 2018



<https://themothersprosperity.org>



# Prosperity

શ્રી માતાજીની

સિદ્ધિ-રિદ્ધિ

2018

MAY

૧ મે, ૨૦૧૮

— Let us Pray —

— પ્રાર્થના કરીએ —

Mother, be with me, now and always.

Envelope me with your presence.

Raise and purify me with your touch.

Inhabit me with your living image.

Transform all dullness and darkness into bright  
and perfect faith.

Transform all restlessness and agitation into  
invulnerable calm and peace.

Transform all attachment into a deep  
and stainless purity.

Mother, liberate and change me, perfect your child.

— Sri Aurobindo

માતાજી, તમે મારી સાથે રહો, હમણાં અને હંમેશાં.

તમારી સંનિધિ વડે મને આવરી લો.

તમારા સ્પર્શ વડે મને ઊર્ધ્વ લો, મને શુદ્ધ કરો.

તમારી જીવંત છબી દ્વારા મારામાં નિવાસ કરો.

સર્વ નીરસતા અને અંધકારનું એક તેજસ્વી અને

પૂર્ણ શ્રદ્ધામાં રૂપાંતર કરો.

સર્વ ચંચલતા અને હલનચલનનું એક અખંડનીય સ્થિરતામાં અને

શાંતિમાં રૂપાંતર કરો.

સર્વ અનુરાગનું એક ઊંડી અને નિર્મળ પવિત્રતામાં રૂપાંતર કરો.

માતાજી, મને મુક્ત કરો, મારું પરિવર્તન કરો,

તમારા બાળકને સંપૂર્ણ બનાવો.

— શ્રી અરવિન્દ

In the night as in the day be always with me.  
In sleep as in waking let me feel in me always the reality  
of your presence.  
Let it sustain and make to grow in me Truth, consciousness  
and bliss constantly and at all times.

રાત્રિના તેમ જ દિવસના સમયે હંમેશાં મારી સાથે રહો.  
નિદ્રામાં તેમ જ જાગૃતિમાં આપની હાજરીની વાસ્તવિકતા મને હંમેશાં  
મારામાં અનુભવવા દો.  
એ હાજરી સત્યને, ચેતના અને પરમાનંદને સતત અને સર્વ સમયે ટેકો  
આપતી રહો અને મારામાં તેમની વૃદ્ધિ કરાવતી રહો.

~

My Lord, every day, in all circumstances, let me repeat with  
the full sincerity of my heart,  
“May Thy Will be done and not mine.”

મારા પ્રભુ, દરરોજ, દરેક પરિસ્થિતિમાં, મારા હૃદયની પૂરી સચ્ચાઈથી મને  
રટણ કરવા દો, “તમારો સંકલ્પ બનો મારો નહિ.”

~

Supreme Lord, teach us to be silent so that in silence we may  
receive Thy force and understand Thy will.


હે પરમ પ્રભુ, અમને શાંત રહેતાં શીખવો જેથી શાંતિમાં આપની  
શક્તિને અમે ઝીલીએ અને આપના સંકલ્પને સમજીએ.

– Sri Aurobindo – શ્રી અરવિન્દ

### The Purpose of Prayer

**All prayer rightly offered brings us closer to  
the Divine and establishes a right relation with Him.**

**(“Rightly offered” means with humility and sincerity.)**



OM has a transforming power.  
OM represents the Divine...  
OM is the Signature of the Lord.

With the help of OM one can realise the Divine.  
If anything goes wrong,  
repeat OM, all will go well.

ૐ પાસે રૂપાંતર કરવાની શક્તિ છે.  
ૐ પ્રભુનો પ્રતિનિધિ છે.  
ૐ પ્રભુના હસ્તાક્ષર છે.

ૐ ની મદદથી પ્રભુનો સાક્ષાત્કાર કરી શકાય છે.  
કાંઈ પણ ખોટું બને તો  
ૐ નું રટણ કરો, બધું બરાબર થશે.

- The Mother - શ્રી માતાજી